

647510**0101225E2030****Seat No: _____****B.A. Semester - 2 (CBCS) Examination****March/April- 2018****ECONOMICS : P3 PRINCIPLES OF ECONOMICS-2
(ELECTIVE-2)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-૧ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનાં ખ્યાલો ઉદાહરણ અને આકૃતિની મદદથી સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૧ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનાં આંતરસંબંધો આકૃતિ દ્વારા સ્પષ્ટ કરો.
- પ્રશ્ન-૨ ઉદ્યોગ વિકાસનાં લાભોની ચર્ચા કરો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૨ ઘટતા મળતરનો નિયમ સમજાવો.
- પ્રશ્ન-૩ ભાડાનો આધુનિક સિદ્ધાંત સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૩ સાધનનાં મૂલ્ય નિર્ધારણનો પ્રશ્ન શા માટે અલગ રીતે વિચારવામાં આવે છે?
- પ્રશ્ન-૪ “નફો નવપ્રવર્તનનું પરિણામ છે” - ચર્ચા કરો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૪ નફાનો ગતિશીલતાનો સિદ્ધાંત સમજાવો અને તેની ટીકાઓ જણાવો. (૧૪)
- પ્રશ્ન-૫ ટ્રેકનોંધ લખો: (કોઈપણ બે) (૧૪)
- (૧) વૈકલ્પિક ખર્ચનાં ખ્યાલની મર્યાદાઓ.
- (૨) આભાસી ભાડું.
- (૩) પેઢી વિકાસનાં લાભો.
- (૪) ઘટતા મળતરનાં નિયમની ઉપયોગિતા.

English Version

- Que-1 Explain the concept of fixed cost and variable cost with the help of illustration and figure. (14)
OR
- Que-1 Clarify the interrelationships between Average cost and marginal cost with the help by diagram.
- Que-2 Discuss the advantages of expansions size of Industry. (14)
OR
- Que-2 Explain the law of Diminishing Returns.
- Que-3 Explain the modern theory of rent. (14)
OR
- Que-3 Why is the issue of price determination of factors of production separately thought?
- Que-4 "Profit is a result of innovation" – Discuss. (14)
OR
- Que-4 Explain the dynamic theory of profit and criticize it.
- Que-5 Write a short note on. (any two) (14)
- (1) Limitations the concept of opportunity cost.
 - (2) Quasi-Rent.
 - (3) The advantages of expansion size of firm.
 - (4) Usefulness of the law of diminishing return.
